

ይት የዚህ ማኅበር በፌዴራል ነው

III 2

አግሪ ሳሽን

ካርሎ ለiddimēnt

ባሳሊዮ ገዢሞ, ደቧิด ፊሬ

፩

ይተክክል የዚህ ማኅበር በፌዴራል ነው

III 2

አግሪ ሳሽን

ካርሎ ለiddimēnt

ባሳሊዮ ገዢሞ, ደቧidal ፊሬ

፩



<https://creativecommons.org/licenses/by/3.0>

Attribution 3.0 International License.

This work is licensed under a Creative Commons



አግሪ ሳሽን (ccb)

ካርሎ ለiddimēnt

ባሳሊዮ ገዢሞ, ደቧidal ፊሬ

have no hair

አማርኛ የዚህ ማኅበር / Why hippos


globalstorybooks.net

Global Storybooks



Why hippos have no hair

አማርኛ የዚህ ማኅበር / Why hippos



رۆژیکیان کە رویشە به لیوارى رووباریک دا رویشت.


...

One day, Rabbit was walking by the riverside.

Hippo was there too, going for a stroll
and eating some nice green grass.

...

لِحَّىٰ مُهَاجِرٌ مُهَاجِرٌ مُهَاجِرٌ مُهَاجِرٌ
مُهَاجِرٌ مُهَاجِرٌ مُهَاجِرٌ مُهَاجِرٌ مُهَاجِرٌ



ئەسپى ئاوى بەرپىي خۆى نەبىنى و بە بە خۆى نەبۇو
كەپىي لە سەرپىي كەرويىشک دانا. كەرويىشک قىزاندى
وھلارى كرده ئەسپى ئاوى : ”ھۆى ئەسپى ئاوىيى!
نابىنى پىت لەسەرپىي من داناوه؟”

...

Hippo didn't see that Rabbit was there
and she accidentally stepped on
Rabbit's foot. Rabbit started screaming
at Hippo, "You Hippo! Can't you see that
you're stepping on my foot?"

كەرويىشک خۆشىل بۇو بە وھى مۇوھكلىنى ئەسپى
ئاوىيى سووتان. لەو رۆزھوھ ئەسپى ئاوىيى لە ترسى
ئاگر لە ئاوهكە دور نەكەتتۈوهتەوھ.


...

Rabbit was happy that Hippo's hair was
burned. And to this day, for fear of fire,
the hippo never goes far from the
water.

Hippo apologised to Rabbit, "I'm so sorry. I didn't see you. Please forgive me!" But Rabbit wouldn't listen and he shouted at Hippo, "You did that on purpose! Someday, you'll see! You're going to pay!"

...

„I...”
 હિપ્પોનું રહેતું હતું કાગળની પત્રની લાંબા અંગળની પાણી વિનાંકાના માં તુંદરની હસ્તાક્ષરની ચીજી દ્વારા રાખા જાતું હતું.
 હિપ્પોનું તુંદરની પાણી પર આપી એવી તુંદરની અંગળી જે કાગળની પત્રની લાંબા અંગળની પાણી વિનાંકાના માં રાખી જાતું હતું.
 હિપ્પોનું રાખે જાતું હતું હસ્તાક્ષરની ચીજી અંગળી.



Hippo started to cry and ran for the water. All her hair was burned off by the fire. Hippo kept crying, "My hair has burned in the fire! My hair is all gone! My beautiful hair!"

...

“એ...”
 હિપ્પોનું રહેતું હતું કાગળની પત્રની લાંબા અંગળની પાણી વિનાંકાના માં તુંદરની હસ્તાક્ષરની ચીજી દ્વારા રાખા જાતું હતું.
 હિપ્પોનું તુંદરની પાણી પર આપી એવી તુંદરની અંગળી જે કાગળની પત્રની લાંબા અંગળની પાણી વિનાંકાના માં રાખી જાતું હતું.
 હિપ્પોનું રાખે જાતું હતું હસ્તાક્ષરની ચીજી અંગળી.



که رویشک رۆیشت و ئاگرى دۆزىيەوه و پىى گوت: ”بىرۇ
ئەسپى ئاوىيى بسووتىنە كاتىك لە ئاوه كە دېتە دەرىز بۆ¹
خواردىنى گزوگىا. ئەو پىى لە من نا!“ ئاگر وەلامى
دایەوه: ”ھىچ كىشە نىيە، كە رویشىكى ھاورپىم. من رېك
ئەو كاره دەكەم كە تو داواتلى كىدم.“

...

Rabbit went to find Fire and said, “Go,
burn Hippo when she comes out of the
water to eat grass. She stepped on me!”
Fire answered, “No problem, Rabbit, my
friend. I’ll do just what you ask.”

پاشان ئەسپە ئاوىيى كە لە قەراغ پووبارە كە گزوگىاي
دەخوارد، لە ناكلاو بلېسىھى ئاگر ھەستا. بلېسىھى ئاگرە كە
دەستى بە سوتاندى مۇوەكلىنى ئەسپە ئاوىيى كە كرد.

...

Later, Hippo was eating grass far from
the river when, “Whoosh!” Fire burst
into flame. The flames began to burn
Hippo’s hair.